

બં. અ. કૃષિ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના નેજા હેઠળ ૧૩મું સ્વ. ડૉ. દિવાકર આર. પટેલ મેમોરીયલ લેક્ચર-વેબિનારનું આયોજન કરવામાં આવ્યું.

બં. અ. કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવની ઊજવણી પ્રસંગે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના નેજા હેઠળ સ્વ. ડૉ. દિવાકર આર. પટેલનું ૧૩મું મેમોરીયલ લેક્ચર-વેબિનારનું આયોજન તા. ૦૯/૦૯/૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું.

માન. કુલપતિશ્રીએ પ્રમુખ સ્થાનેથી પ્લાન્ટ બાયોટેકનોલોજીના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરી આવનાર સમયમાં કેવી રીતે પાક ઉત્પાદન દ્વારા માનવજીવનને મદદરૂપ થવાનું છે તેની સમજ આપી. વિશિષ્ટ નિષ્ણાંત વૈજ્ઞાનિક દ્વારા ગોઠવવામાં આવેલ વેબિનાર અંગે ખુશી વ્યક્ત કરી હતી અને ડૉ. દિવાકર પટેલના પ્રયત્ન ધ્વારા તૈયાર કરવામાં આવેલ ટીસ્યુકલ્ચર લેબોરેટરી તથા સેન્ટર ઓફ એક્સલન્સ ઓન બાયોટેકનોલોજીની કામગીરીને બીરદાવી હતી.

“બાયોટેકનોલોજી - એન ઇમરજન્સ ઓફ પોટેન્શીય એરા” સંદર્ભિત વ્યાખ્યાયન-લેક્ચર, કોલેજ ઓફ બાયોટેકનોલોજી, મેરઠના પ્રાધ્યાપક અને પૂર્વ ડીનશ્રી ડૉ. એસ. કે. ભટનાગર દ્વારા બં. અ. કૃષિ મહાવિદ્યાલયના ઓડીટોરીયમ થી લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ડૉ. એસ. કે. ભટનાગર જેઓએ બાયોટેકનોલોજીના અગત્યના નવા આયામો વિશે સર્વને માહિતગાર કર્યા હતા અને આવનાર પડકારોને કેવી રીતે પ્લાન્ટ બાયોટેકનોલોજી માનવજીવનને ઉપયોગી થશે તેની સુંદર રીતે આગવી શૈલીમાં સમજ આપેલ.

સંશોધન નિયાકશ્રી ડૉ. એમ. કે, ઝાલાએ બાયોટેકનોલોજીના સંશોધન અને તેની ઉપયોગીતા વિશે પોતાની વાત રજૂ કરી હતી. વધુમાં તમણે જણાવ્યું કે કોવિડનો સમય એ બાયોટેકનોલોજીના ત્રીજા રીવોલ્યુશનને સમય છે.

કોલેજના આચાર્ય અને ડીનશ્રી તથા બં. અ. કૃષિ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ ડૉ. વાય. એમ. શુક્લે કોલેજના અમૃત મહોત્સવ અને દેશની આઝાદીકા મહોત્સવ ટાંણે સર્વ મહાનુભવોનું સ્વાગત કરતા જણાવ્યું કે સ્વ. ડૉ. દિવાકરની યાદમાં દર વર્ષે

પ્લાન્ટ બાયોટેકનોલોજીના વિષયોને આવરી લઇ જ્ઞાનવર્ધક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ સર્વે માટે ખૂબ જ માહિતીસભર હોય છે.

ડૉ. આકર્ષ પરીહારે ડૉ. દિવાકરના જીવન ઝરમર અને તેમના યોગદાનની માહિતી આપી હતી. ડૉ. સુશિલકુમારે પ્રખર વૈજ્ઞાનિક ડૉ. સુબોધ ભટનાગરનો પરિચય કરાવ્યો હતો. ડૉ. કે. સી. પટેલ, સેક્રેટરી, એલમની એસોસિએશન ધ્વારા બે પીજી વિદ્યાર્થીઓને ડૉ. આર. એમ. પટેલ સ્કોલરશીપની જાહેરાત કરી મહાનુભવોના હસ્તે સ્કોલરશીપના ચેક એનાયત કરવામાં આવ્યા. ડૉ. જીગર મિસ્ત્રીએ આ મેમોરીયલ લેક્ચરમાંસહાયરૂપ થનાર નામી-અનામીસર્વનો અભાર વ્યક્ત કર્યો હતો.



